

Extra No. 46



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXIV]

SATURDAY, MARCH 4, 2023 / PHALGUNA 13, 1944

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

જાહેરનામું

સચિવાલય, ગાંધીનગર, ૪થી માર્ચ, ૨૦૨૩

ક્રમાંક : જીએચવાય/૬/૨૦૨૩/જીઓઆઈ/૧૩૨૦૧૦/૧૩/એ: ગુજરાત ગેઝેટમાં તા.૧૩મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ અસાધારણ રાજપત્ર
ક્રમાંક : ૨૦૩, ભાગ-૪બી માં પ્રસિદ્ધ થયેલા આ વિભાગના જાહેરનામા ક્રમાંક : GHY/30/GOI/132010/A, તા.૧૩મી સપ્ટેમ્બર, ૨૦૨૨નો
ગુજરાતી અનુવાદ સામાન્ય જાણકારી માટે પ્રસિદ્ધ કરવામાં આવે છે.

પ્રકાશ પટ્ટણી,
સરકારના સંયુક્ત સચિવ.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
જાહેરનામું
સચિવાલય, ગાંધીનગર, ૧૩મી સપ્ટેમ્બર, ૨૦૨૨

ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ, ૨૦૨૧.

ક્રમાંક : જીએચવાય/૩૦/જીઓઆઈ/૧૩૨૦૧૦/એ: ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ, ૨૦૨૧ (સન ૨૦૨૧ના ગુજરાતના અધિનિયમ ક્રમાંક. ૧૮મા)ની કલમ-૧ની પેટા-કલમ (૩) થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, ઉપર્યુક્ત અધિનિયમની જોગવાઈઓ જે તારીખે અમલમાં આવશે, તે તારીખ તરીકે સન ૨૦૨૨-ના સપ્ટેમ્બર મહિનાની ૧૩મી તારીખ નક્કી કરે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
પ્રકાશ પટણી,
સરકારના સંયુક્ત સચિવ.

